

# રાજકોટ મહાનગરપાલિકા

ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧

-: અખબારી યાદી:-

"પ્લાસ્ટિક છોડો ભારત" કાર્યક્રમ હેઠળ કિસાનપરા ચોક ખાતે જેલમા કેદ થયા "માય એફ.એમ." ના આર.જે. આભાબેન

તારીખ: ૨૩-૦૧-૨૦૨૦



રાજ્ય સરકારશ્રી દ્વારા રાજકોટ શહેરમાં રાજ્ય કક્ષાની પ્રજાસત્તાક પર્વ- ૨૦૨૦ની ઉજવણી અંતર્ગત તા.૨૩-૦૧-૨૦૨૦ થી તા.૨૫-૦૧-૨૦૨૦ સુધી એક વિશિષ્ટ પ્રકારનો કાર્યક્રમ " પ્લાસ્ટિક ભારત છોડો " નું આયોજન કરવામાં આવશે. જેમાં આજે સવારે ૧૦:૦૦ વાગ્યે કિસાનપરા ચોક ખાતે એક જેલ બનાવવામાં આવેલ છે અને "માય એફ.એમ." ના આર.જે. આભાબેન આ જેલમાં ૭૨ કલાક સુધી કેદ થયા છે. શહેરની વિવિધ સ્કૂલોના છાત્રો અને રાજકોટ મહાનગરપાલિકા શહેરમાંથી ૫૦૦ કિલો પ્લાસ્ટિક એકત્ર કરી જેલ ખાતે લાવશે અને ત્યારે આર.જે. આભાબેન જેલમુક્ત થશે. આજે માન.મેયર શ્રી બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને આ પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ શ્રી

કમલેશભાઈ મીરાણી, ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણી, ડે. મેયરશ્રી અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષના નેતાશ્રી દલસુખભાઈ જાગાણી, શહેર ભાજપ મહામંત્રીશ્રી દેવાંગભાઈ માંકડ, મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ, પૂર્વ ડે. મેયરશ્રી ડો. દર્શીતાબેન શાહ, સેનિટેશન સમિતિના ચેરમેનશ્રી અશ્વિનભાઈ ભોરણીયા, પ્લાનીંગ સમિતિના ચેરમેન શ્રી અનીતાબેન ગૌસ્વામી, એસ્ટેટ સમિતિના ચેરમેન શ્રી પ્રીતીબેન પનારા, કોર્પોરેટરશ્રી દેવુબેન જાદવ, નાયબ મ્યુનિ. કમિશનરશ્રી બી.જી.પ્રજાપતિ, પર્યાવરણ ઈજનેરશ્રી નીલેશભાઈ પરમાર તેમજ વિવિધ સ્કુલોના છાત્રો અને વિવિધ સંખ્યાના પ્રતીનીધીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઈ ભંડેરીએ પોતાના પ્રત્યાઘાતમાં એમ જણાવ્યું હતું કે, “પ્લાસ્ટિક છોડો ભારત” નો આ કાર્યક્રમ એકદમ નવો અને લોકોમાં વધુ જાગૃતિ પ્રસરાવે તેવો છે, આ માટે હું સૌને અભિનંદન પાઠવું છું. માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વિકાસની જે કેડી હંકારી છે તેમાં ગુજરાત પણ ઉત્સાહભેર આગળ ધપી રહ્યું છે, અને રાજકોટ મહાનગરપાલિકા પણ ખુબ સારી રીતે પોતાનું યોગદાન આપી રહેલ છે.

આ કાર્યક્રમને અનુલક્ષીને માન. મેયરશ્રીએ જણાવ્યું હતું કે, શહેરને સ્વચ્છ બનાવવાની શરૂઆત આપણાથી જ કરીએ, જો શહેર સ્વચ્છ રહેશે તો આપણું ઘર પણ સ્વચ્છ રહેશે, પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો પણ નહિ અને જે લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે તેને પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા જણાવો. પ્લાસ્ટિક મુક્ત રાજકોટ કરવા માટે આ કાર્યક્રમ થકી એક નવી પહેલ લાવીએ છીએ.

મ્યુનિ. કમિશનરશ્રીએ સંદેશો આપતા જણાવ્યું હતું કે, શહેરીજનોના સહયોગથી રાજકોટ શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ આવી શકશે, આ શહેરને સ્વચ્છ રાખવાની આપણી સૌની જવાબદારી છે, આજે આ કાર્યક્રમ થકી શહેરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા લોકો સુધી એક સંદેશ પહોંચશે કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો એ જેલની સજા બરાબર છે, તો મારી નમ્ર અપીલ છે કે લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે અને સૌ સાથે મળીને રાજકોટ શહેરને સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ લાવીએ. “પ્લાસ્ટિક છોડો ભારત” કાર્યક્રમ અન્યત્ર પણ પ્રેરણારૂપ બનશે. પર્યાવરણની સુરક્ષા અને જાળવણી માટે આપણે સૌ પ્રતિબદ્ધ થઈએ.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શહેરીજનો પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરે અને સ્વચ્છતા અંગે જાગૃતતા આવે તેવા ધ્યેય સાથે રાજકોટ મહાનગરપાલિકા અને માય.એફ.એમ. ના સંયુક્તે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ સાથે શહેરની વિવિધ સ્કૂલોના છાત્રો તેમજ સ્વામીનારાયણ અને બ્રહ્મકુમારીઝ જેવી જુદીજુદી સંસ્થાઓ સહભાગી થઈ શહેરમાંથી પ્લાસ્ટિક કચરો એકત્ર કરી કિશાનપરા ચોક પાસે બનાવવામાં આવેલ જેલ પાસે ભેગો કરીને આર.જે. આભાબેનને મુક્ત કરશે.

(જન સંપર્ક અધિકારી)  
રાજકોટ મહાનગરપાલિકા